

B.A. Semester - 3 (CBCS) Examination
Oct/Nov - 2022 (OLD COURSE)
ECONOMICS OF MONEY & BANKING-1(CORE)

Time: 2:30 Hours**Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

-
- પ્રશ્ન.૧ નાણું એટલે શું? નાણાંના મુખ્ય કાર્યોની ચર્ચા કરો. (૧૪)
 અથવા
- પ્રશ્ન.૧ નાણાંના ઉદ્ભવની વિગતે ચર્ચા કરો.
- પ્રશ્ન.૨ ભાવ સૂચકાંક એટલે શું? ભાવ સૂચકાંકની રચના પદ્ધતિની મર્યાદાઓ સમજાવો. (૧૪)
 અથવા
- પ્રશ્ન.૨ “વ્યાપારી બેંકો પાતળી હવામાંથી શાખનું સર્જન કરતી નથી” - સમજાવો.
- પ્રશ્ન.૩ પ્રો.ફિશરના નાણા પરિમાણના સિદ્ધાંતની સમજૂતી આપો. (૧૪)
 અથવા
- પ્રશ્ન.૩ નાણાંના રોકડ પુરાંતના સિદ્ધાંતની મર્યાદાઓની ચર્ચા કરો.
- પ્રશ્ન.૪ વ્યાપારી બેંકોના ધિરાણનાં કાર્યોની વિગતે સમજૂતી આપો. (૧૪)
 અથવા
- પ્રશ્ન.૪ ચેક એટલે શું? ભારતમાં ચેકનાં મહત્વની સમજૂતી આપો.
- પ્રશ્ન.૫ ટુંકનોંધ (કોઇપણ-બે) (૧૪)
1. બેંક થાપણોનાં પ્રકારો.
 2. નાણાના વિવિધ ઘટકો.
 3. રોકડ અનામત દરમાં ફેરફારની નીતિ.
 4. ભારતમાં ચેકની લોકપ્રિયતા.

ENGLISH VERSION

- Q.1 What is Money? Discuss the main functions of Money. (14)
 OR
- Q.1 Discuss in detail the Origin of Money.
- Q.2 What is Price Index? Explain the limitations of Price Index Formulation Method. (14)
 OR
- Q.2 “Commercial banks do not create credit out of thin air” - Explain.
- Q.3 Explain Prof. Fisher's theory of Monetary Dimension. (14)
 OR
- Q.3 Discuss the limitations of Cash Flow Theory of Money.
- Q.4 Explain in detail the Lending Functions of Commercial Banks. (14)
 OR
- Q.4 What is a Cheque? Explain the importance of Cheque in India.
- Q.5 Notes (any-two) (14)
1. Types of Bank Deposits.
 2. Different Components of Money.
 3. Cash Reserve Rate Change Policy.
 4. Popularity of Cheque in India.
